



રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન
જૂની અનસુયા લેપ્રસી હોસ્પિટલનું કેમ્પસ, આજવા રોડ,
વડોદરા.



Certificate Course in Community Health (CCCH)

પ્રવેશ પરીક્ષા નોટીસ - ઓગસ્ટ ૨૦૧૯

સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (CCCH) બેચ નં.- ૭ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન નીચે દર્શાવ્યા મુજબ કરવામાં આવેલ છે.

પરીક્ષાનાં કેન્દ્રો: ૧) GMERS મેડીકલ કોલેજ, ગોત્રી, વડોદરા.

૨) સરકારી નર્સિંગ કોલેજ, વેક્સિન કેમ્પસ, નવી કોર્ટ બિલ્ડિંગ પાસે,
ઓલ્ડ પાદરા રોડ, વડોદરા.

૩) બરોડા મેડીકલ કોલેજ, વડોદરા.

૪) રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન, જૂની અનસુયા
લેપ્રસી હોસ્પિટલ કેમ્પસ, આજવા રોડ, વડોદરા.

૫) ફેકલ્ટી ઓફ સાયન્સ, MS યુનિવર્સિટી, વડોદરા.

૬) પારુલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ, લીમડા - વડોદરા.

પરીક્ષાની તારીખ: ૧૮/૦૮/૨૦૧૯, રવિવાર

પરીક્ષાનો સમય: સવારે ૧૧:૦૦ થી ૧૩:૦૦ વાગ્યા સુધી

નોંધ: પ્રવેશ પરીક્ષા માટે લાયક ઉમેદવારોના નામ, સીટ નંબર, પરીક્ષા કેન્દ્ર દર્શાવતું લીસ્ટ અને ઉમેદવારનું ADMIT CARD ટૂંક સમયમાં વેબસાઈટ પર મુકવામાં આવશે.

પરીક્ષા અંગેનાં નિયમો આ સાથે સામેલ છે. જે બિનચૂક ધ્યાને લેશો.

-/ સહી /-

નિયામક

રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન
વડોદરા

CCCH - ઓગસ્ટ ૨૦૧૯ પ્રવેશ પરીક્ષા અંગેના નિયમો

: પરીક્ષામાં પ્રવેશ અંગેના નિયમો :

❖ મોબાઈલ ફોન / લેપટોપ / ટેબ્લેટ / કેલ્ક્યુલેટર / પેજર વિગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહિ. જો ઉમેદવાર આવા સાધનો સાથે પકડાશે તો તેની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી.

1. ઉમેદવારે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ અને NHM ની વેબસાઈટ (<https://gujhealth.gujarat.gov.in/> , <https://nhm.gujarat.gov.in/>) પર ઉપલબ્ધ કરેલ પોતાના નામ વાળું ADMIT CARD સાથે લાવવું ફરજિયાત છે.
2. ADMIT CARD વગર કોઈ પણ સંજોગોમાં પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહિ.
3. ઉમેદવારે પોતાના નામ અને બેઠક ક્રમાંક ચકાસી પોતાના ADMIT CARD ની બંને કોપી પર પોતાનો PASSPORT SIZED ફોટોગ્રાફ ચોટાડીને આવવું.
4. ફોટોગ્રાફ વગરના ADMIT CARD સાથે ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ જેની નોંધ લેવી.
5. ADMIT CARD સહીત valid photo ID proof જેવાકે આધારકાર્ડ / પાનકાર્ડ / ડ્રાઈવીંગ લાયસન્સ / પાસપોર્ટ વગેરે રજીસ્ટ્રેશન કાઉન્ટર પર બતાવ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે.
6. નામમાં ફેરફારના કિસ્સામાં ઉમેદવારે પોતાના બંને નામ અંગેના પુરાવા તરીકે Govt Gazette Copy / Marriage Certificate ઝેરોક્ષ નકલ જમા કરાવવી ફરજિયાત છે.
7. પરીક્ષાખંડમાં ADMIT CARD ફરીથી ચકાસવામાં આવશે. જેમાં સુપરવાઈઝરની હાજરીમાં ઉમેદવારે નિશ્ચિત દર્શાવેલ જગ્યાએ સહી કરવાની રહેશે. સહી અગાઉથી કરીને આવવું નહિ.
8. ADMIT CARD ની INVIGILATOR COPY જમા કરાવવાની જવાબદારી ઉમેદવારની રહેશે. જે ઉમેદવાર તે જમા કરાવશે નહિ તેમનું પરિણામ મુલતવી રાખવામાં આવશે.

: પરીક્ષાના નિયમો:

1. પરીક્ષા બહુ વિકલ્પીય પ્રશ્નો (Multiple Choice Questions) દ્વારા લેવામાં આવશે.
2. ૧ માર્કનો એક એવા ૧૦૦ પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષાનું પ્રશ્નપત્ર કુલ ૧૦૦ માર્ક્સ નું રહેશે.
3. પરીક્ષાનો સમય સવારે ૧૧:૦૦ થી ૧૩:૦૦ નો રહેશે.

4. પરીક્ષા સ્થળે રીપોર્ટિંગ ટાઈમ સવારે ૦૯:૦૦ વાગ્યાનો રહેશે. સીટ નંબર મુજબનો પરીક્ષાખંડ પરીક્ષાર્થીએ પોતે નોટીસબોર્ડ પરથી સુનિશ્ચિત કરી લેવાનો રહેશે.
5. પરીક્ષાખંડમાં પ્રવેશ પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાથી આપવામાં આવશે.
6. પરીક્ષા દરમિયાન પરીક્ષાખંડ માંથી બહાર જઈ શકાશે નહિ.
7. પરીક્ષા વખતે માત્ર બ્લુ કે બ્લેક બોલપેન અને ઓળખ કાર્ડ (Photo ID proof) જ લઈને આવવાનું રહેશે.
8. પરીક્ષા વખતે મોબાઈલ ફોન / કેલ્ક્યુલેટર / પેજર / લેપટોપ / ટેબ્લેટ વિગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ વર્જિત છે.
9. ઉમેદવાર નકલ કરવાનો પ્રયત્ન કરશે, પરીક્ષાની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરશે કે ડમી ઉમેદવારી માલુમ પડશે તો તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે અને ભવિષ્યમાં તે ક્યારેય આ કોર્સ માટે ઉમેદવારી નોંધાવી શકશે નહિ.
10. પરીક્ષા ના સ્થળે આપનો સર-સમાન રાખવાની સગવડ કરવામાં આવશે નહિ, તેમ છતાં કોઈ સામાન લાવશે તો સામાન ચોરાઈ જાય, ખોવાઈ, ગુમ થઈ જાય કે બદલાઈ જાય તો તેની જવાબદારી ઉમેદવારની પોતાની જ રહેશે.
11. પાર્કિંગ જગ્યા મર્યાદિત હોઈ યોગ્ય સહકાર આપવો.
12. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા દરમિયાન સ્વયં શિસ્ત ની અપેક્ષા અને આગ્રહ રાખવામાં આવે છે. જેથી સૌ ઉમેદવાર તથા તેના સગા-વ્હાલાએ યોગ્ય સહકાર આપવા વિનંતી છે.

: પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ :

1. B.Sc. nursing / GNM / BAMS નાં બેઝીક કોર્સનો સંપૂર્ણ અભ્યાસક્રમ.
2. રાષ્ટ્રીય અને રાજ્ય આરોગ્ય કાર્યક્રમો / યોજનાઓ.
3. સામાન્ય જ્ઞાન.
4. ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ અને ભાષા.
5. ગુજરાત રાજ્યનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાત રાજ્યની સંસ્કૃતિ.

----- X -----